



### સીટી આ વસંતઋતુમાં રહેવાસીઓને સુરક્ષિત રહેવાનું યાદ અપાવે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 17, 2021) – હવામાન ગરમ રહેવાની આગાહી છે ત્યારે, સીટી ઓફ બ્રેમ્પટન આ વસંતઋતુમાં રહેવાસીઓને સુરક્ષિત રહેવાનું યાદ અપાવે છે. ઋતુઓમાં ફેરફારથી જુદા જુદા જોખમો ઊભા થાય છે જેનાથી દરેક વ્યક્તિએ માહિતગાર હોવું રહ્યું.

આ શિયાળામાં બરફના વાવાઝોડાનો કચરો, હિમપાત અને બરફ જમવા જેવી વિવિધ સ્થિતિઓ અને હમણાં, આગામી વસંતઋતુમાં વરસાદને લીધે, સીટીની ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસ સરેરાશ પૂરના જોખમ કરતા વધારે જોખમ રહેવાની સલાહ રહેવાસીઓને આપે છે. ધ્યાનમાં રાખવા જેવા પૂર સંબંધિત સુરક્ષા સૂચનો નીચે જણાવેલા છે:

- પોલીસ, અગ્નિશમન કે એમ્બ્યુલન્સની જરૂરિયાત ઊભી થાય તેવી કોઈ કટોકટી માટે 9-1-1 નંબર પર તાત્કાલિક કોલ કરવો.
- મ્યુનિસિપલ રોડ્સ, વાવાઝોડાથી ભરાયેલા નાળાઓ (બ્લોકડ સ્ટોર્મ સીવર ગ્રેટ્સ) કે બેઝમેન્ટ ભરાવવા સંબંધિત જાણ કરવા, [311](#) નંબર પર સંપર્ક કરો.
- નદીઓ અને ઝરણાઓમાં પાણીના ઊંચા સ્તરોની જાણ કરવા, સોમવારથી શુક્રવાર સવારે 8:30 થી બપોરે 4:30 વાગ્યા સુધી [ક્રેડિટ વેલી કન્ઝર્વેશન ઓથોરિટી](#)નો સંપર્ક કરવો, અને ફ્લડ ડ્યુટી ઓફિસર સાથે વાત કરવી.
- તમારી મિલકતનું સંરક્ષણ કરો. પૂર આવે તે પહેલાં, તમે ગટર સુધી પાણી વહેવાનો માર્ગ આપ્યો હોવાની ખાતરી કરો. જો તેમ કરવું સુરક્ષિત ન હોય તો, તમારી મિલકત પરનો માર્ગ સૌથી નજીકની કેચ બેસિન (કૂડી) કે સ્ટ્રીટ સુધી ચોખ્ખો રાખો જેથી કરીને પાણી મુક્તપણે વહી શકે છે. તમારી મિલકત પર વધારાનો બરફ સાફ કરી નાખો. કેચ બેસિન્સ અને ડાઉનરૂપાઉટ્સ (નીચે જતી નળીઓ) ભરાયેલી કે બંધ ન હોવાની ખાતરી કરો.
- જો પૂર આવે તો, પાવર બંધ કરવાનો પ્રયત્ન કરશો નહિ જો તમારે તેમ કરવા પાણી મારફતે ચાલવાની ફરજ પડે. પાવર બંધ કરવા એલેક્ટ્રા (Alectra) નો સંપર્ક કરો. પાણી ઈલેક્ટ્રિકલ આઉટલેટ્સ, ઉપકરણો (એપ્લાયન્સીસ) કે કોર્ડ્સ (વાયરો) સાથેના સંપર્કમાં આવી શકે તેવા રૂમમાં ક્યારેય પ્રવેશશો નહીં.
- પૂરનો પ્રવાહ ઓછો થયા પછી, ફૂગ અને પાણી જમવાને સંબંધિત લાંબા-ગાળાના જોખમોનું સંરક્ષણ કરવા તમારા ઘર/મિલકતની યોગ્ય સફાઈ કરવાની ખાતરી કરો.
- પૂરથી ભરાયેલા રસ્તાઓ પર ચાલશો નહિ કે ડ્રાઈવ કરશો નહીં. ભરાયેલા પાણીથી સ્ટ્રીટ્સ અને સાઈડવૉક્સની સુરક્ષા પ્રભાવિત થઈ શકે.

રહેવાસીઓને નદીઓ, ઝરણાઓ, તળાવો (વરસાદી પાણીથી ભરાયેલા ખાબોચિયા સહિત), જળાશયો, વેટલેન્ડ્સ (કાયમી કે ઋતુલક્ષી ભરાતા ખાબોચિયાઓ), અને માર્શીસ (નીચાણની ભેજવાળી જમીન) પર સ્કેટ્ટિંગ ન કરવાનું પણ યાદ અપાવવામાં આવે છે, કારણ કે હવામાનમાં વધઘટ થવાથી બરફ પીગળવાને લીધે, અને દોખરેખના અભાવને લીધે સ્કેટ્ટિંગ કરવું અસુરક્ષિત હોય છે. સીટી ઓફ બ્રેમ્પટને સ્થાનિક નદીઓ અને તળાવો પર રહેવાસીઓને સ્કેટ્ટિંગ ન કરવા દેવા નજીકમાં સાઈનેજ (સાઈન બોર્ડ્સ)નું અમલીકરણ કર્યું છે. સ્કેટ્ટિંગ માટે નિર્ધારિત અને ચિહ્નિત વિસ્તારો સિવાય સરોવર કે ઝરણાં પર સ્કેટ્ટિંગ કરવું તે [સીટીના પાર્ક લેન્ડ્સ બાય-લાં](#) હેઠળ ઉલ્લંઘન ગણાય છે. બિન-અનુપાલન માટે મહત્તમ \$5,000 સુધી દંડ કરવામાં આવે તેવું બની શકે.

આ વસંતઋતુમાં સુરક્ષિત રહેવાની રીત પર વધુ સૂચનો અને પૂરની સ્થિતિમાં સંપર્કો અને સંસાધનોની સંપૂર્ણ યાદી માટે વેબસાઈટ જુઓ, [www.brampton.ca](http://www.brampton.ca)



## Service and Information Update

### ਮਿਡਿਆ ਸੰਪਰਕ

ਗੁਰਵਿੰਦਰ ਸਿੰਘ

ਸੰਕਲਨਕਰਤਾ, ਮਿਡਿਆ ਐਂਡ ਕਮਿਊਨਿਟੀ ਐਂਗੇਜਮੇਂਟ

ਸਟ੍ਰੈਟੇਜਿਕ ਕਮਿਊਨਿਕੇਸ਼ਨਜ਼

ਸਿਟੀ ਓਫ਼ ਬਰੈਮਪਟਨ

905-874-2028 | [Gurvinder.A.Singh@brampton.ca](mailto:Gurvinder.A.Singh@brampton.ca)